

નામ. હાઇકોર્ટના ચુકાદા પ્રમાણે મે. કોટા દાલ  
મિલ, કોટા, રાજ્યસ્થાનને આકસ્મિક નિધિમાંથી  
ચુકવણું કરવા બાબત

ગુજરાત સરકાર

મહિલા અને બાળ વિકાસ વિભાગ,

હુકમ ક્રમાંક: આઇસીડી/૧૧૨૦૧૭/૩૨૨/૫

સચિવાલય, ગાંધીનગર.

તા. ૨૮/૦૨/૨૦૨૨

### વંચાણે લીધા:

- (૧) મહિલા અને બાળ વિકાસ વિભાગના ઠરાવ ક્રમાંક: આઇસીડી/૧૧૨૦૧૭/૩૨૨/૫,  
તા. ૦૬/૦૬/૨૦૨૧.
- (૨) નામદાર ગુજરાત હાઇકોર્ટ (SCA 8881/2021) નો ચુકાદો, તા. ૨૧/૧૦/૨૦૨૧.
- (૩) કમિશરશ્રી, મ. અને બા. વિ. કચેરી, ગાંધીનગરના તા. ૦૬/૦૨/૨૦૨૨ના પત્ર ક્રમાંક: L-  
2/ICDS/KDM/INT/બજેટ/ગ્રાંટ/૨૦૨૨ થી કરેલ દરખાસ્ત.
- (૪) નામદાર ગુજરાત હાઇકોર્ટ (MCA 79/2022 in SCA 8881/2021)નો ચુકાદો,  
તા. ૦૬/૦૨/૨૦૨૨.
- (૫) નાણાં વિભાગના મેમોરેન્ડમ ક્રમાંક: સીએનએફ/૧૧૨૧/૫૧/૬ તા. ૧૭/૦૨/૨૦૨૨.
- (૬) નામદાર સુપ્રીમ કોર્ટ (SLP 1623/2022) નો ચુકાદો, તા. ૨૫/૦૨/૨૦૨૨.

### પ્રસ્તાવના

વંચાણે લીધા (૧) પરના હુકમથી કોટા દાલ મિલ, કોટા ના પ્રીમીક્ષ ઉપર લાગુ  
પડતા વેટ/CST ના દર ૫% થી વધારી ૫.૫% કરવાની મંજૂરી આપવામાં આવેલ છે તેમજ કોટા  
દાલ મિલ, કોટાને ૦.૫% વેટના દરે વિથહેલ રાખેલ રકમ રૂ.૨,૮૪,૮૧,૮૪૭/- અને તે ઉપર ૮%  
લેઝે વ્યાજની રકમ રૂ.૨૬,૫૩,૩૬૬/- મળી કુલ રૂ.૩,૨૧,૩૪,૨૧૩/-ની રકમ આકસ્મિક નિધિમાંથી  
ચુકવવાની મંજૂરી આપવામાં આવેલ છે. વંચાણે લીધા (૨) પરથી નામદાર ગુજરાત હાઇકોર્ટ  
દ્વારા વિથહેલ રાખેલ રકમ રૂ.૨,૮૪,૮૧,૮૪૭/- અને તેના પર રૂ.૧,૨૩,૩૬,૩૭૬.૧૬ વ્યાજની  
ચુકવણી કરવા જણાવેલ. વંચાણે લીધા (૩) પરથી કમિશરશ્રી, મ. અને બા. વિ. કચેરી દ્વારા  
રૂ.૧,૨૩,૩૬,૩૭૬ ના વ્યાજની ચુકવણી કરવા તેમજ સદર રકમની જોગવાઈ આકસ્મિક  
નિધિમાંથી કરવા દરખાસ્ત કરેલ. વંચાણે લીધા (૪) પરથી નામ. ગુજરાત હાઇકોર્ટ દ્વારા કંટેમ્પ્રટ  
ઓફ કોર્ટની નોટિસ ઇસ્યુ કરેલ છે. વંચાણે લીધા (૫) પરથી નાણાં વિભાગ દ્વારા ચુકવવાની થતી  
રૂ. ૧,૨૩,૩૬,૩૭૬ ની વ્યાજની રકમ આકસ્મિક નિધિમાંથી ચુકવવાની મંજૂરી આપવામાં આવેલ  
છે. વંચાણે લીધા (૬) પરના નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાથી સદર બાબતની એસ.એલ.પી.  
ડિસ્મીસ કરેલ છે.

ઉપરોક્ત તમામ બાબતોને ધ્યાને લઈને મે.કોટા દાલ મિલને રૂ.૧,૨૩,૩૬,૩૭૬/- વ્યાજની ચુકવણી કરવાની બાબત વિચારણા હેઠળ હતી. પુખ્ત વિચારણાને અંતે નીચે મુજબ ઠરાવવામાં આવે છે.

## ઠરાવ

નામ. ગુજરાત હાઇકોર્ટના તા.૧૭/૦૮/૨૦૨૧ના હુકમ અન્વયે વિભાગના સરખા કમાંકના તા. ૦૬/૦૬/૨૦૨૧ ના હુકમથી મે.કોટા દાલ મિલ, કોટાને પ્રીમીક્ષ ઉપર લાગુ પડતી વેટ/CST ની વિથહેલ રાખેલ રકમ રૂ.૨,૬૪,૮૧,૮૪૭/- (રૂ. બે કરોડ ચોરાણું લાખ એકચાશી હજાર આંઠસો સુડતાલિસ પુરા) નું ચુકવણું કરવાની મંજુરી આપવામાં આવેલ છે.

નામદાર સુપ્રીમ કોર્ટમાં એસ.એલ.પી. નં. ૧૬૨૩/૨૦૨૨ ના તા.૨૫/૦૨/૨૦૨૨ ના ચુકાદા અન્વયે નામ. ગુજરાત હાઇકોર્ટના તા.૨૧/૧૦/૨૦૨૧ના ચુકાદા અનુસાર મે.કોટા દાલ મિલ, કોટાને પ્રીમીક્ષ ઉપર લાગુ પડતા વેટ/CST ના વિથહેલ રાખેલ રકમ રૂ.૨,૬૪,૮૧,૮૪૭/- (રૂ. બે કરોડ ચોરાણું લાખ એકચાશી હજાર આંઠસો સુડતાલિસ પુરા) ઉપર વ્યાજની રૂ.૧,૨૩,૩૬,૩૭૬/- (રૂ. એક કરોડ ત્રેવિસ લાખ ઓગણચાલીસ હજાર ત્રણસો છોતેર પુર) ની રકમ આકસ્મિક નિધિમાંથી ચુકવવાની નીચેની શરતોને આધીન મંજુરી આપવામાં આવે છે:

- (૧) આકસ્મિક નિધિથી મેળવેલ રકમનો વર્ષ ૨૦૨૧-૨૨ ના સુધારેલ અંદાજમાં સમાવેશ કરવાનો રહેશે. તેમજ આ રકમનો કુલ અંદાજપત્રીય જોગવાઇની મર્યાદામાં સમાવેશ કરવાનો રહેશે.
- (૨) આ સમગ્ર રકમનો ખર્ચ આકસ્મિક નિધિના મુખ્ય સદર "૮૦૦૦" હેઠળ જ ઉધરાય તેની ચોકસાઈ રાખવાની રહેશે તથા નાણાં વિભાગના તા.૨૪/૦૧/૧૯૮૦ ના પરિપત્ર ક: હસવ-૧૦૮૦-૨૧૬-ક ની સૂચનાઓ અનુસાર મંજુર કરવામાં આવેલ પેશગીમાંથી ખર્ચ મેળવવાનો હોય તેવા કિસ્સાઓમાં ઉપાડના દરેક બીલ/વાઉચરો ઉપર ઉપાડ અધિકારીએ સ્પષ્ટ રીતે લાલ શાહીથી "આકસ્મિક ખર્ચ નિધિ" મુજબના શબ્દો લખવાના અને એ મુજબ જ આકસ્મિક નિધિ પેશગીમાંથી મેળવવામાં આવનાર ખર્ચની મંજુરીના હુકમોમાં પણ કરવાનો રહેશે.
- (૩) નાણાં વિભાગના તા.૨૩/૫/૧૯૮૫ ના પરિપત્ર મુજબ જાહેર હિસાબ સમિતિની ભલામણ અનુસાર આકસ્મિક નિધિમાંથી પેશગી મંજુર થયાના બે(૨) માસમાં તેનો ખર્ચ કરવાનો રહે છે. તેથી તે પરત્વે કોઈ ખર્ચ ન થાય અથવા ઓછો ખર્ચ થાય તો આ પેશગીની મંજુરી રદ કરવા અથવા તેની રકમમાં ઘટાડો કરવાની દરખાસ્ત વિભાગને સત્ત્વરે કરવાની રહેશે.

- (૪) આકસ્મિક નિધિમંથી પેશગીની રકમ વર્ષ ૨૦૨૧-૨૨ નાં અંદાજપત્રમાં બજેટ સદર ૧૦૬-૨૦૪૮-૬૦-૭૦૧-૦૧ (મહેસુલી/બિનમત્રપાત્ર) હેઠળ રૂ.૧,૨૩,૩૬,૩૭૯/- (૩. એક કરોડ ત્રૈવિસ લાખ ઓગણચાલીસ હજાર ત્રણસો છોતેર પુર) ની ફાળવણી કરવામાં આવે છે.

આ ઠરાવ વિભાગની સરખા કમાંકની ફાઇલ ઉપર નાણાં વિભાગની તા.૧૬-૦૨-૨૦૨૨ ની નોંધથી મળેલ મંજૂરી અન્વયે કરવામાં આવે છે.

ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રીના હૃકમથી અને તેમના નામે,

*JPVAScra*  
ઉપ સચિવ

મહિલા અને બાળ વિકાસ વિભાગ  
પ્રતિ,

- માન. રા.ક. મંત્રીશ્રી,(મ.બા.ક.) (સ્વતંત્ર હવાલો) ના અંગત સચિવશ્રી, સચિવાલય, ગાંધીનગર
- સચિવશ્રી(આ.બા.), નાણા વિભાગ, સચિવાલય, ગાંધીનગર
- સચિવશ્રી(ખર્ચ), નાણા વિભાગ, સચિવાલય, ગાંધીનગર
- કમિશરશ્રી, મહિલા ને બાળ વિકાસ કચેરી, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર
- નિયમકશ્રી (આઇસીડીએસ), કમિશરશ્રી મહિલા ને બાળ વિકાસ કચેરી, ગાંધીનગર
- એકાઉન્ટન્ટ જનરલશ્રી, રાજકોટ/અમદાવાદ
- નાણા સલાહકારશ્રી, મહિલા અને બાળ વિકાસ, નાણા વિભાગ, સચિવાલય, ગાંધીનગર
- પગાર અને હિસાબી અધિકારી, ગાંધીનગર
- મે.કોટા દાલ મિલ, કોટા (નિયમકશ્રી(આઇસીડીએસ) કચેરી મારફત)
- શાખા સિલેક્ટ ફાઇલ.